

एकम – ८ मम दिनचर्या


अ अने ब योग्य रीते जोडो.

अ	ब
(1) उत्तिष्ठम्	(1) सार्धं एकादशवादने
(2) भोजनम्	(2) सप्त वादन पर्यन्तम्
(3) योगासनम्	(3) दशवादने
(4) अध्ययनम्	(4) षड् वादने
(5) शयनम्	(5) नव वादनतः


नीचेना शब्दोनो विदुद्धार्थी शब्द आपो.

- (1) आगमन
- (2) प्रातः
- (3) सायम्
- (4) मम
- (5) उत्तिष्ठ
- (6) दिन


લંબચોરસ ખાનામાં આપેલ સમય મુજબ ઘડિયાળમાં કાંટા દોરો




12:00




2:00




6:00




8:00




9:00




11:00




1:00




5:00




4:00



7:00



10:00



3:00